

શ્રી સુદર્માસુવિજયાળિ

દેખાણ ગંગેશ્વર
નાના


દાદાશાહેથ, ભાગનગર,
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૫૬

૪૩૩

મંસૂરિ જૈન અંથમાળા પુષ્પ. ૨૩.


રોભન મુનિ

અને તેમની ઝૂતિ.



: લેખક :

મુનિરાજ શ્રી હિમાંશુ વિજયાળિ.



: દ્રોય સહાયક :

પાડિવ (જીરોહી સ્ટેટ-મારવાડ) વાળા.

શેઠ લુંખાળ ઉમાળ.



: પ્રકાશક :

દીપચંદ ખાંડીયા

મંત્રી—શ્રી વિજયધર મંસૂરિ જૈન અંથમાળા.

છોટા સરાક ઉજાનેન (માદવા)



ધર્મ સં. ૧૩

વીર સં. ૨૪૬૯

વિકલ સં. ૧૯૮૭

કિંમત રણ ચાના.

વિ....૪....યો....નું....સાં....ક....હી....થું

(શોભનમુનિનું જીવન)

શોભનમુનિનું એક કવિત્વ...	૨
શોભનના પૂર્વને અને તેનું પ્રારંભિક જીવન	૩
ધારાનગરી	૪
દટાએલું ધન મધ્યું	૫
ઉપકારનો બદલો	૬
શોભન; ખાલણું અટી અમણું થયો	૭
શોભનમુનિની પ્રગનિ	૭
ધનપાળનો છોધ અને જૈન સાધુનો વિહાર અંધ	૮
સંધની વિનતિ અને શોભનમુનિનું ધારામાં જવું	૮
ધનપાળને પ્રતિસોધ અને એ ભાઈઓની લેઠ...	૧૦
જ્યારે ધનપાળ જૈન ધર્મ સ્વીકારી પોતાનું જીવન	
જૈન ધર્મને સાંપે છે	૧૧
ધનપાળનો ટૂંક પરિચય	૧૩
માળવામાં જૈન સાધુએં	૧૪
શોભનમુનિનું વ્યક્તિત્વ	૧૪
શોભનમુનિની ઝૂતિ	૧૫
શોભનમુનિનું અવસાન	૧૭

(ઐતિહાસિક આદોચના)

મતભેદનું કોષ્ક	૧૮
ગામની પરીક્ષા	૧૯
શોભનના પિતા	૨૧
શોભનમુનિના ગુરુ	૨૨
શોભનનું ગૃહસ્થ કુટુંબ	૨૪
શોભનસ્તુતિયતુર્વિશતિકાની ટીકાએં	૨૪
ઉપયોગી પરિશાષ્ટો	૨૭

મુદ્રક—શાહ ગુલાભયંદ લલુભાઈ—મહોદ્ય પ્રિ. પ્રેસ. દાણાપીઠ—લાવનગર.


श्री विजयधर्मसूरि.

जन्म वि. सं. १६२४

भारुदा.

दीक्षा सं. १६४३

लालनगर.



आचार्यपद सं. १६६४

काशी.

निर्वाण सं. १६७८

शिवपुरी.

सत्पाथोजविकासवासरकरो गाम्भीर्यरत्नाकरो
धर्मोद्घारिसमाजदेशसुखदः प्रानन्दकन्दाम्बुदः ।
श्रद्धाज्ञानचरित्रनिर्मलबलः कुन्देन्दुकीर्त्योऽवलः:
सूरिः श्रीविजयादिधर्ममुनिः स्याद् भूयसे श्रेयसे ॥

—अनेकान्ती.

श्री भण्डार्य प्रेस-लालनगर.

મહાકવિ શોભન મુનિ

અને

તેમની કૃતિ.

‘કવિ’ જગતની એક અનેરી વિભૂતિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ અદ્ધિસ છે. હજારો ધનાઢ્યો કે રાજાઓ જગતને જે લાલ ન આપી શકે તે લાલ ધારે તો એક સાચા કવિ આપી શકે છે. કવિને ‘કવિત્વ શક્તિ’ શોધવા જવું પડતું નથી. સ્વયમેવ તે શક્તિ સાચા કવિને વરવા આવે છે. આવો કુદરતી કવિજ જગતને અવનવો આનંદ આપી શકે છે. ‘કવિ’ જગતના ગમે તેવા પદાર્થેનું સૂક્ષ્મતમ નિરીક્ષણ કરી તે પદાર્થને પોતાની કદ્વયના શક્તિથી વર્ણવી સુંદર બનાવે છે, અને તે દ્વારા તેમાં તે અનેરો રસ ઉત્પન્ન કરે છે. એ જ કવિની ખરી પૂણી છે. ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ એ લોક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થકતા ગણી શકાય.

જેમ એક રાણ કે ધની અસુક દેશ કે કાળને માટે જ સરળયેલો હોય છે; તેમ કવિ નથી હોતો. સાચો કવિ તો તમામ જગત અને બધા કાળ માટે સરળયેલો હોય છે, કેમકે તે પોતાના યશઃ—શરીરથી સદ્ગ જીવતો જગતો રહી, પોતાની પાછળ મુકેલી કૃતિનો લાલ જગતને સતત આપતો જ રહે છે. કવિ મનુષ્યલોકમાં પણ પોતાની અનુપમ પ્રતિભાથી સાક્ષાતું સ્વર્ગનો અનુભવ કરી; ખીલને પણ તેનો સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આવો જ કવિ સાચો કવિ કહી શકાય, અન્યથા ‘કવય: કપય: સ્મૃતાઃ’ (કવિઓ વાંદરા છે.) ની કહેવત લાગુ પડે.

આવા કુદરતી જન્મસિદ્ધ એષ કવિઓ આ ભારતમાં થતા આવ્યા છે, તેમાં જૈનોએ મોટો હિસ્સો આપ્યો છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન મુનિઓ અને ગૃહસ્થોએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને વ્યક્તિ કરી નાખ્યું છે. સંસ્કૃત, પ્રાકૃત ગૂજરાતી અને કાન્ફી ભાષામાં તો કેટલાક જૈન કવિઓનું નામ અઠારમો સદ્ગ સુધી મોખરે રહ્યું છે.

આપણું પ્રસ્તુત સ્તુતિકાર આ ‘શ્રી શોભન મુનિ’ પણ તેવા વિશેષ કુદરતી કવિઓ પૈકીના એક એષ શોભન મુનિનું કવિ હતા; એમ માનવામાં તેમની ઉપદ્ધતિ શ્રેષ્ઠ કવિત્વ. એક જ ‘જિનસ્તુતિચતુર્વિશતિકા’ કૃતિ આપણુંને પ્રેરે છે. તેમની ખીજુ કૃતિઓ જરી નથી, અને કદાચ તેમણે ન પણ બનાવી હોય; છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને એષ કવિ કહેવામાં કોઈપણ જતનો વાંદ્યો નથી.

‘જૈમનાં ઘણું કાંયો મળતાં હોય તે જ મોટા કવિ છે’ આવી માન્યતા સાચી નથી. પોતામાં કવિત્વ શક્તિ સારામાં સારી હોવા છતાં કેટલાક મહાકવિઓ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય બનાવ્યા વગર જ આ જગત છોડીને

ચાલ્યા જાય છે, કેટલાએક બીજા વિષયના થંથો ખનાવવામાં આનંદ કે લાલ માની કાવ્યના થંથો થોડા ખનાવે છે. અથવા ખનાવતા ય નથી. આવા અનેક દાખલા મળે છે. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે ‘કવિ’ નહિ માનીએ તો એક મોટી લૂલ જ ગણ્યાય, લયંકર અન્યાય જ થાય, એમ મારું માનવું છે. જો તેમ ન હોય તો ‘સિદ્ધસેન દિવાકર’ કે જેઓનું ‘કલ્યાણ મંહિર સ્તોત્ર’ સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગી મળ્યું નથી, છતાં તેમને માટે, હજરો શ્લોકેનાં કાવ્યો રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાન કવિ “અનુસિદ્ધસેનં કવયः” (સિ૦ હૈ૦ ૨-૨-૩૯ પૃ૦ ૭૨) કહી તેમને મહાકવિનું માન આપે છે; તેથી એમ માનવું જોઈએ કે કાવતા ખનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હોવી જુદી વસ્તુ છે. આપણા ‘શોલનમુનિ’ પણ તેવા જ કવિ હતા, કે જેઓ શાખદાલાંકાર અને લક્ષ્ણના પૂર્થી છલકતી ‘જિનસ્તુતિચતુર્વિશતિકા’ નામની એક જ કૃતિ જગતને આપી તરુણવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની આદો-ચના કરવાનું કામ આગળ ઉપર રાખી, આ કૃતિના કર્તા (શોલનમુનિ) ના જીવન ચરિત્ર તરફ હું વાચકેને લઇ જવા માગું છું.

શ્રી શોલન મુનિના જીવન ઉપર પ્રકારા.

અત્યાર લગી પ્રકાશિત થએલ જ્ઞાના અને નવા થંથોમાં શ્રી શોલન મુનિનું જીવન ચરિત્ર ખણું જ દૂંકાણુમાં, અને તે પણ અપૂર્ણ મળે છે. તેમનાં જન્મસ્થાન, માતા, પિતા અને ગુરુનાં નામના સંખ્યામાં અનેક અંથકારો જુદા જુદા મત આપે છે, પણ મને તો આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (શોલન મુનિના વડીલ ભાઈ) ના અંથો, પ્રલાવક ચારિત્ર અને પ્રભાંધ ચિંતામણિ વધુ પ્રામાણિક લાગે છે.

શોભન મુનિનું જીવન લિખ લિખ એ પ્રકારના સંસ્કારોથી ઘડાયું
છે—જન્મથી તેમનામાં વૈદિક સંસ્કારે
શોભનના પૂર્વને પોષાયા છે અને દીક્ષા પદ્ધીથી જૈન
અને તેનું પ્રાર- સંસ્કારોએ તેમાં અપૂર્વ સુધારણા કરી
લિક જીવન. નવું તેજ ઉત્પત્ત કર્યું છે. જન્મથી તેઓ
વૈદિક ધ્યાનથું હતા. સહુ પહેલાં આપણે તેમના
લાઈ ધનપાળની કૃતિ ‘તિલકમંજરી’ તરફ નજર નાખીશું.
મહાકવિ ધનપાળ પોતાનો પરિચય^૯ આપતાં તેમાં લખે છે:—

મધ્યદેશ કે જેને આજકાલ સંચુક્ત પ્રાંત (મૃ. પી.)
કહેવામાં આવે છે, તેમાં આવેલા ‘સાંકાશ્ય’ નગરનો રહેવાસી
‘દેવખી’ ધ્યાનથું હતો. તેનો પુત્ર ‘સર્વદૈવ’ થયો, કે શાસ્ત્ર-
કળા અને અંથ રચવામાં નિપુણ હતો. આ સર્વદૈવને એ પુત્રો થયા,
મોટો ‘ધનપાળ’ અને નાનો ‘શોભન’. આપણા વરિત્રનાયક
આ જ શોભન છે. ધનપાળના પિતા સર્વદૈવ, ‘લોજ’ ની
‘ધારા’ (ધાર) નગરીમાં આવી રહ્યા હતા. તેમના બંને પુત્રોનો
જન્મ કર્યાં થયો, તેનો નષ્ઠે ખુલાસો જો કે આપણુંને ભળતો
નથી, પણ અનુમાનથી કહી શકાય કે, સર્વદૈવ ધણા વર્ષોથી
ધારામાં આવી રહ્યા હુશે, આ હિસાબે આ બંને તેમના પુત્રોનો
જન્મ ધારામાં થયો હોય એમ લાગે છે.

જે વળતે રાજ ‘લોજ’ માળવાનું રાજ્ય કરતો હતો તે
વળતની ‘ધારા’ નગરી ધણી જાહેરલાલી-
ધારાનગરી. વાગી હતી. અનેક વીરો, વિદ્યાનો અને ધન-
ધ્યોથી તે નગરી શોભી રહી હતી. વિદ્યાના

^૯ “ આસીદ્ દ્વિજન્માઽખિલમધ્યદેશો પ્રકાશસાક્ષાદ્યનિવેશજન્મા ।

અલઘ દેવાર્થરિતિ પ્રસિદ્ધિ યો દાનવર્ષિતવિભૂષિતો�પિ ॥ ૫૧ ॥

શાસ્ત્રેષ્વધીતી, કુશલ: કલાસુ, વન્યે ચ બોધે ચ ગિરાં પ્રકૃષ્ટઃ ।

તસ્ય�ત્તમજન્મા સમભૂત્મહાત્મા, દેવઃ સ્વર્યંભૂરિવ સર્વદૈવઃ ॥ ૫૨ ॥”

તિલકમંજરીની પીઠિકા

સુગંધી વાતાવરણુથી મહેકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતોનો ત્યાં ગર્વ ઉત્તરો જતો હતો. સારા વિદ્ધાનું કવિઓને લાખોનાં ધનામ અને મોટી ધૂજગત એનાયત કરવામાં આવતાં હતાં. સરસ્વતી અને લક્ષ્મી બન્નેનો ત્યાં સાથે વાસ હતો.

રાજા ‘લોજ’ કેવળ ચોણ્ય રાજાજ નહિ પણ, એક અઠંગ વિદ્ધાનું અને રસિક કવિ પણ હતો કે જેના વ્યાકરણુની છિયાથો ગુજરાતના રાજા સિદ્ધરાજજયસિંહે શ્રી હેમચંદ્રાચાર્યને પ્રાર્થના કરી ‘સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન’ બનાવરાઈયું. (જ્ઞાનો આ વ્યાકરણુની મારી પ્રસ્તાવના). તે સાચા વિદ્ધાનોનો પોષક અને અનુમોદક હતો; તેથી સર્વદૈવ પંડિત આ નગરીમાં રહેતો હતો. આવા વિદ્ધા-વ્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના બને પુત્રોને પણ વધારે અનુભવ મેળવવાનો અવસર મળી આવ્યો. ધનપણ અને શોભનને તેના પિતા પાસેથી પરંપરા પ્રાપ્ત વિદ્ધા તો મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુદા જુદા પંડિતોના સમાગમથી તેમનો વિદ્ધામાં ધણો સારો વધારો થયો. ધીમે ધીમે આ બને લાઇઓએ પોતાની પ્રતિલાથી ધારાના પંડિતો અને લોજરાજાના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું. તેઓ બન્ને આખા ય માલવાના પંડિતોમાં પંકવા લાગ્યા.

વિદ્ધાનો માટે ધણો લાગે હુંમેશાં બને છે તેમ સર્વદૈવ પંડિત ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન ન હતાં. તેના દ્યાયલું ધન પિતાએ ધરમાં પુષ્કળ ધન દાટયું હતું, મહ્યું. પરન્તુ તે કંયે સ્થળે દાટયું છે? તેની ખખર સર્વદૈવને નહિ હતી. તે પોતાના ધરમાં દ્યાયલું ધન મેળવવા ચાહુતો હતો. એક હિવસે તપસ્તેજ અને વિદ્ધતાથી શોભતા ‘શ્રીમહેન્દ્રસૂરિ’ ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યની વાત રાજ પ્રજ અને પંડિતોમાં ઝેલાઈ. સર્વદૈવે આ આચાર્યનો સમાગમ કર્યો. આચાર્ય ઉપર તેનો પ્રેમ અને વિશ્વાસ વધતો ગયો. આચાર્ય આગળ તેણે પોતાની ગરીબાઈની વાત

૧ પ્રથમચિતામણિમાં વર્ધમાનસૂરિ આવ્યાતું લખ્યું છે, તેની આલોચના આગળ કરીથું.

કાડી પોતાના ધરમાં દટાયેલ ધનને ખતાવવા સાથે હિનતિ કરી. તે આચાર્યે તેના ધરમાં દટાયેલ ધન ખતાવ્યું. સૂરિણુએ ખતાવેલા સ્થળમાં સર્વહૈવને મોટી ધનરાશિ પ્રાપ્ત થઈ. ધનના આનંદથી તે ગાંડો ઘેલો થઈ ગયો. ધન અગ્યારમો પ્રાણુ છે. બાળકથી વૃષ્ટ, મૂર્ખથી પંડિત, ખાંધા ય જેની રાતદિવસ જંખના કરે છે તેનાથી કેમ આનંદ ન થાય?

સર્વહૈવ, પંડિત હેલા સાથે પૂરૈપૂરૈ કૃતજ્ઞ હતો. સૂરિણુના ઉપકારનો ખદલો આપવા તે ચાહતો હતો. તેણે મળી આવેલા ધનનો અર્ધો લાગ લેવા સૂરિણુને પ્રાર્થના કરી, પણ તેઓ તો પંચમહાવતધારી જૈનાચાર્ય હતા. પરિશ્રહથી તદ્દન હૂર રહેનાર નિર્થન્થ; ધનને શું કરે? એક કોડી પણ સૂરિણુએ લીધી નહિ. અંતે સર્વહૈવની પ્રાર્થનાથી સૂરિણુએ એક રસ્તો ખતાવ્યો:— “ઉપકારનો ખદલો આપવો જ હેલા તો તારા એ પુત્રોમાંથી એક પુત્ર મને આપ, જેથી જગતમાં તારું પણ નામ થાય.” આ ઉત્તર સાંલળી સર્વહૈવ પુત્રપ્રેમને લીધે સંકોચાયો; પણ ઉપકારનો ખદલો આપવાનો વિચાર તેને એચેન ખનાવતો હતો. પ્રલાવકચરિત્રકાર લખે છે કે:—તે વિચારમાં તેનું આખું વર્ષ વીતી ગયું. અંતે તીર્થમાં જઈ મહેન્દ્રસૂરિના ઉપકારનો ખદલો નહિ આપવા સંખાંધી પોતાના પાપને ઘોવાનો વિચાર કરી સર્વહૈવે પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન સમયે ધનપાળો કારણું પૂછતાં ઉત્તરમાં સર્વહૈવે જણાયું કે:—“ મારું જણું ચુકાવવા એમાંથી એક પુત્રની જૈનાચાર્ય માગણી કરે છે. આ જણું ચુકાવ્યા વગર હું મરી જઉં તો મારી સહગતિ થાય નહિ; તેથી તે પાપ ઘોના તીર્થમાં જઉં છું.”

પિતાની વાત સાંલળી ધનપાળ ચ્યામક્યો અને કોધથી સર્વહૈવને કહેવા લાગ્યો કે:—“તમે પોતાના પુત્રને ઉપકારનો ખદલો. જૈન દીક્ષા અપાવી આપણું કુળને કલાંકિત કરવા માંગો છો? આપણું કુળમાં શુદ્ધ યજાયાગાદિ વેદપાઠ કરનાર પ્રાણણો થયા છે. પ્રાણણો અને શ્રમ-

હુંમાં હુંમેશાંથી વિરોધ ચાલતો આવે છે. આવી અવસ્થામાં જૈન સાધુને તમે પુત્ર કેમ આપી શકો ? જો તમે તેમ કરશો તો હું તમારો પણ સંબંધ છોડી દઈશ. ” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વદૈવનો ગભરાટ વધે છે; ત્યારે તે વધતે સર્વદૈવનો નાનો પુત્ર ‘શ્રોલભન’ પિતા પાસે જઈ કહે છે કે:—‘પિતાજી તમે કંઈ પણ ચિંતા કરશો નહિ. ઉપકાર વાળવાની તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ.’ ‘શ્રોલભન’ તેના પિતાનો એક સાચો લક્ષ્ય પુત્ર હતો. ‘ગુરોરાજા ગરીયસી’ ના સિદ્ધાન્તમાં માનનારો હતો. સાચે સાચે જૈન સાધુનાં અહિસા, તપ અને સંયમનું મહત્વ પણ તે સમજતો હતો, તેથી તેણે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું બીજું જડ્યેયું.

પ્રતિજ્ઞાને પૂરી કરવનારાં પુત્રનાં અમૃતમય વચનો સાંભળી સર્વદૈવના હૃદયમાં આનંદની ઉર્મિઓ. ઉછ-શ્રોલભન; ખાલણુ જવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સર્વદૈવે મટી અમણુ થયો. આશીર્વાદપૂર્વક પોતાનો પુત્ર સૂરિજીને સેંગ્યો. શ્રોલભન ‘ખાલણુ’ મટી ‘અમણુ’ થયો. મહેન્દ્રસૂરિ; આ નવા શિષ્ય સાચે અન્યત્ર વિહાર કરી ગયા. બહુ થોડા જ સમયમાં જૈનાગમાદ્દ વિવિધ પ્રકારની વિદ્યા લણી વી સૂરિજીએ પોતાના આ નવા શિષ્યમાં અતુલવ અને પાંડિત્યનું નવું તેજ ઉમેયું.

ગુરુસેવા કરી શ્રોલભનસુનિયો એક બાળુ સમ્યગુદર્શન સાચે સમ્યગુજ્ઞાન મેળવ્યું અને બીજું બાળુ ચારિત્રની સંપત્તિ મેળવી. પૂર્વની વિક્ષતામાં આ વસ્તુએ ઉમેરાતાં તેઓ મહાનુ પ્રલાવશાળી હની ગયા. થોડા વર્ષોમાં પોતાના પ્રાંતમાં જ નહિ; પણ ફર ફરના અનેક પ્રાંતોમાં શ્રોલભનની કીર્તિ ફેલાણી. ક્ષિષ્યની વધતી જતી કીર્તિને જેઠ મહેન્દ્રસૂરિનું હૃદય આનંદથી ઉછળવા લાગ્યું.

આ બાળુ ધનપાળની સખત મનાઈ છતાં શોલને જૈન સાધુ પાસે હીક્ષા લીધી હોવાથી ધનપાળ ધનપાળનો કોધ, પિતા ઉપર હુદ્ધ થઈ પિતા સાથેનો સંબંધ અને જૈન સાધુનો છોડી દીધો. તે જૈન સાધુઓનો પહેલાં કરતાં વિહાર બંધ. વધારે કદર ફુસમન ખની ગયો. તેણે લોજ-રાજના કાન લંબેરી માળવામાં જૈન સાધુને નહિ વિચરવા રાજ હુકમ કઢાવ્યો. લારતમાં ધર્મદ્રોષને લીધે પોતાની સત્તા અને શક્તિઓનો ઓટો ઉપયોગ કરવાના દાખલા આવી જ રીતે ખનતા હતા. માળવામાં જૈન શ્રમણો (સુનિઓ) નાં દર્શન હુલ્લાલ થયાં. આ વાતને જેતનેતામાં બાર બાર વર્ષનાં વહાણું વહી ગયાં. જૈન સાધુઓનો વિહાર બંધ હોવાથી માળવાના જૈન લોકોમાં સર્વત્ર ઉદાસીનતા અર્થે હુઃખની લાગણી ફેલાઈ.

જૈનોમાં ધર્મપ્રેમ અને આત્માલિમાન જગવાથી માળવાના સ્વદે શ્રી મહેન્દ્રસૂરિ પાસે જઇ માળવાની ધર્મ સંબંધી કફ્ફાડી સ્થિતિ કહી સંભળાવી અને તેમને ત્યાં પધારી લોજની અયોગ્ય આશા બંધ કરાવી, જૈનશાસનની પ્રભાવના કરવા વિનિતિ કરી. આ બધી વાત શુરૂપાસે બેઠેલા શોલનમુનિ બહુ જ ચીવટથી સંભળતા હતા. તે વખતે તેઓ ગુજરાતમાં હતા.

શોલનમુનિ ભાણી ગણીને એક અસાધારણ વિક્રાન્ત થઈ ગયા હતા. સચોટ ઉપરેશ આપવાની શક્તિ તેમસંઘની વિનિતિ નામાં સહજે આવી ગઈ હતી, તેથી શુરૂઆએ અને શોલન યોગ્ય ગણી તેમને ‘ વાચનાચાર્ય ’ પદ મુનિનું ધારામાં આપ્યું હતું. પોતાના દેશના (માળવાના) જવું. લોકોની વિનિતિ સંભળી તેમને લાગી આપ્યું છે કે:—‘ આ બધું મારા જ નિમિત્તે થયું છે માટે ગમે તેમ કરીને મારે જ આનો પ્રતિકાર કરવો જોઈએ.’ શોલનમુનિ; ડરપોક અને સુખમાં મસ્ત રહેનાર સાધુ ન હતા, કે જેથી કર્મો ઉપર અથવા કલિકાલ ઉપર દોષ દ્ધ

નિરાશ થઈ એસી રહે. તેમનામાં હિન્મત હતી, શાસનની દાઝ હતી અને ગમે તેવાને સમજલવવાની વિક્રતા પણ હતી. તેથી માળવામાં જઈ બગડેલી સ્થિતિને સુધારવાની પોતાની ઈચ્છા શોભન મુનિએ શુરૂ આગળ કહી બતાવી. ગુરુએ તેમને હરેક રીતે ચોણ્ય સમજી ત્યાં જઈ સુધારો કરવા આજ્ઞા આપી. બસ, પછી શું ? ‘ ઇછું વૈદ્યોપદિષ્ટં ’ ‘ લાવતું હતું ને વૈદ્યે કહું ’ જેવું થયું. ગુરુની આશિષ્ય મેળવી ડેટલાક સાધુઓને સાથે લઈ શોભનમુનિએ ધારા લાણી વિહાર લંખાવ્યો. ઉથ વિહાર કરી થાડી સુહતમાં તેઓ ધ્યારાનગરીમાં પ્રવેશ કરતા દેખાયા. લોકો તેમને અનિમેષ દૃષ્ટિએ ચક્કિત થઈ જેતા હતા. ‘ બારે ! આ જૈન સાધુઓ અહીં કયાંથી ? શા માટે આવ્યા ? હમણું રાજપુરુષો એમને પકડશો. રાજ ગુરુસે થઈને ડોણું જણે શું કરશો. ? ’ આમ જન્યાં ત્યાં લોકો આપસમાં અનેક પ્રકારની વાતો કરતા દેખાતા હતા. જૈન ધર્મના દેખી ડેટલાક લોકોને ઈર્ષ્યા થવા લાગી, જન્યારે જૈનો આનંદથી ઉલરાવા લાગ્યા.

પ્રવેશ કરતી જ વખતે રાજવાડામાં જતો કવિ ધનપાલ રસ્તામાં મહ્યો. જૈન સાધુઓને જોઈ તેમનું ઉપહાસ કરવા એક વાક્ય તેણે કહ્યું:-‘ ગર્દભદન્ત ! ભદન્ત ! નમસ્તે ! ’ અર્થાત્:-ગઘેડા જેવા દાંતવાળા હે મહારાજ ! તમને નમસ્કાર થાયો. ઘણું વર્ષો વીતી જવાથી શોભનમુનિને તે પોતાના ભાઈ તરીકે ઓળખી શક્યો નહિ, પણ શોભનમુનિએ તો ધનપાલને ઓળખી લીધ્યો હતો તેથી ઉપહાસવાળા વાક્યને અનુકૂળ ચમતકારચ્યુક્ત ઉપહાસ-પૂર્વક શોભનમુનિ બોલ્યા કે:-‘ કપિવૃષણાસ્ય ! વયસ્ય ! સુખં તે ? ’ અર્થાત્-વાંદરાના વૃષણુ (અંડકોશ) જેવા સુખવાળા હે મિત્ર ! તું સુખમાં તો છેના ?. પોતાના કરતાં વધુ ચમતકારવાળું શોભનનું પ્રતિવાક્ય સાંલળી ધનપાળ ચમક્યો ને આંખો પડી બોલ્યો કે, ‘ હું તમારી વાક્ય ચતુરાઈથી પરાસ્ત થયો છું. આપ ડોણું છો ? કયાંથી આવો છો ? અને કેના મહેમાન છો ? ’ શોભને ‘ અમે તમારા જ મહેમાન ધીએ ’ એમ કહી ધનપાળને વધારે મુંઝવણુમાં નાખ્યો. શોભનમુનિની વિક્રતાથી આકર્ષાઈ પોતાના

માણુસ સાથે ધનપાળે શોભનમુનિને ઉપાશ્રેયે મોકલ્યા. ધારા-વાસિઓમાં હંતુ કોઈપણ જાણી શક્યું ન હતું કે આ બંને એક જ માતાના પુત્ર સગા લાઇ છે.

ધારાની સ્થિતિ સુધારવા શોભનમુનિના મનમાં અનેક સંકલ્પ વિકલ્પો થવા લાગ્યા. તેઓ બાહેશ અને ધનપાળને પ્રતિ-ચુક્તિબાજ હતા. તેમણે પોતાના સાધુઓને બોધ અને એ ધનપાળને લ્યાં ગોચરી લેવા મોકલ્યા. પ્રશાંત ભાઈઓની લેટ. આકૃતિવાળા એ જૈન મુનિઓએ જૈન ધર્મના કંદ્રર હુસ્મન ધનપાળના ઘેર જઈ ધર્મ લાલનો પવિત્ર નાદ સંભળાવ્યો. ધનપાળ તે વખતે સ્નાન કરતો હતો. તેની સ્વીએ સાધુને કહ્યું કે ‘અહીં ખાવાનું નહિ મળે, ચાલ્યા જવ.’ ધનપાળ પોતાની સ્વીને કહ્યું કે:—‘ અતિથિને નિરાશા કરવો તે મોટો અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ.’ તે સ્વી ત્રણ દિવસનું દહીં લાવી મુનિને આપવા લાગી. મુનિએ પ્રશ્ન કર્યો કે:—‘બહેન, આ કેટલા દિવસનું છે ?’ ઉત્તરમાં તે ચિડાઈને બોલી ‘ આમાં જીવણા (પોરા) પડી ગયાં છે શું ? લેવું હોય તો લો નહિ તો રસ્તો પકડો.’ મુનિ બોલ્યા કે:—‘ બહેન તમે ન કામો કોઈ શા માટે કરો છો ? અમારો આચાર છે માટે પુણીએ છીએ. હવે રહી જીવણાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે:—એ દિવસ ઉપરાંત દહીંમાં ખટાશ વધતી જાય છે, તેથી તેમાં તે રંગના જીવો ઉત્પન્ન થાય છે એમ જૈન શાસ્ત્રો કહે છે. તેની સાક્ષાત્ પ્રતીતિ કરવી હોય તો અલતો લાવી દહીંમાં નાખો.’ ધનપાળ ત્યાં આવી આ બાધી વાત રસપૂર્વક સંભળતો હતો. તેણે કૌતુક જોવાની ખાતર અથવા તત્ત્વ નિક્ષેપ કરવાની ખાતર અલતો મંગાવી દહીંમાં નાખ્યો. બોડી વારમાં જ તેમાં કેટલાક તે જ વર્ણના—દહીંના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપાળનું હૃદય આ દર્શય જોઈ પીગળયું. બહુ આશ્ર્ય થતાં તેના હૃદયે પલટો અધ્યા. જૈન ધર્મની અદ્ધાનું તેનામાં બીજ રોપાયું. જાણે શાસ્ત્રમાં પરાસ્ત થયો હોય; તેમ નાનું થઈને તે મુનિને

કહેવા લાગ્યો કે, આપ કોણ છો ? કોના શિષ્ય છો ? ક્યાં ઉત્તર્યો છો ? મુનિઓ ચોંચ ઉત્તરો આજ્યા પછી મુનિઓની સાથે જ ધનપાળ ઉપાશ્રય લાણી ચાહ્યો.

શોલન મુનિઓ પોતાની ચુક્તિથી કે સુંદર પરિણામ ધાર્યું હતું તે જ આવ્યું. તે પરિણામનો સાક્ષાત્કાર કરવાની તેચો વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને હૃદથી આવતો જોઈ પોતાના મહોટા ભાઈ સમજી, અથવા તેને વધુ આકર્ષિત તેચો (શોલન-મુનિ) થોડા સામે આવ્યા. ધનપાળને મધુર વચનથી શોલનમુનિઓ બોલાવ્યો, અને માનપૂર્વક તેને સમાન આસને બેસાડ્યો. જ્યારે ધનપાળને ખખર પડી કે આતો ‘મારો નાનો ભાઈ શોલન છે’ ત્યારે તેનું હુદ્દ્ય પ્રેમ અને લંજાલથી વિચિત્ર પ્રકારનું હન્દ્યું, તેમાં શ્રદ્ધા અને વાતસલ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન વધ્યું. ધનપાળે શોલનમુનાને કહ્યું કે:--‘તમે જૈન દીક્ષા લઈ આપણું કુળને ખરેખર અજવાખ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છો, શાસ્ત્રના પારંગત છો, માટે મને સાચો ધર્મ બતાવો.’ શોલનમુનિને જોઈતું હતું તેજ થયું. તેઓએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચનથી જૈન ધર્મના સર્વવ્યાપિ અકાશ્ય સિદ્ધાન્તો અને આચારોનો મહાકવિ ધનપાળને સુંદર પરિચય કરાવ્યો. ધનપાળ એક મહાન् પંડિત તો હતો જ એટલે જૈન સિદ્ધાન્તો સમજવામાં તેને મુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધર્મ સાચા બુદ્ધિશાળીઓને માટે જોટલો જઈથી સુકર અને આદરણીય થઈ રહ્યે છે તેટલો અનલિઙ્ગો-અદ્વયબુદ્ધિવાળાઓ માટે નહિ.

શોલનમુનિનો શોલન અને સાત્ત્વિક ઉપહેશ સાંલળી આનંદ-પૂર્વક અતિ ભાવુક શાખ્દોથી ધનપાળે કહ્યું જ્યારે ધનપાળ કે:--‘આજે મેં સાચો ધર્મ જાણ્યો છે જૈનધર્મ સ્વી- માટે અત્યારથી જ હું તે જૈન ધર્મ

કારી પોતાનું સ્વીકારી તેનું શરણું લઈ છું. પહેલાં જીવન જૈનધર્મને જૈન ધર્મનો દ્રેષ કરી આ પ્રદેશમાં ખાર સોંપે છે. વરસ સુધી જૈન સાધુનો વિહાર જંધ કરાવ્યો તે મેં મોટો અપરાધ કર્યો છે. અત્યારે હું તે મારી લયંકર ભૂલનો પશ્ચાત્તાપ કરું છું.' આખાય માળવામાં પંકાયેલ વિદ્ધાનું કવિ ધનપાળ ઉપર શોભનમુનિના ઉપરેશની કેટલી સંચોટ અસર થઈ હશે તેનું અનુમાન, તેના શ્રદ્ધા, અક્ષિત અને નાગતાથી ભરેલા આ શફ્ફોથી સહેલે કરી શકાય છે.

આ પણી તત્કાલ મહાકવિ ધનપાળો, શોભન મુનિની સાથે મહાવીર પ્રલુના મંદિરમાં જધ લાવપૂર્વક પ્રલુની સ્તુતિ કરી વિદ્ધિપૂર્વક જૈન ધર્મ સ્વીકાર્યો. ધનપાળના જીવનમાં આજે મહાનું પરિવર્તન થયું. એક વળતનો જૈનધર્મનો મહાનું વિરોધી પ્રાણું પંડિત આજે જૈનધર્મનું શરણું સ્વીકારી ચુસ્ત જૈન બને છે. હવેથી લોજરાજનો માનીતો રાજપંડિત અને ખાણુના ખીંચ અવતાર સમે ધનપાળ કવિ પોતાની વિક્રિતા અને યશ જૈનધર્મને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાનું પરિવર્તનનો યશ: અને પુણ્ય આપણા ચારિત્ર નાયક શોભનમુનિને જ છે. શોભનમુનિના જીવનમાં આ એક મહાનું કાર્ય થયું. ધણા વળતની તેમની લાવના સફળ થતાં તેમના આત્મામાં આનંદ અને સંતોષ થયો. તેઓ પોતાનું સફળ જીવન વિશેષ સફળ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે ગ્રલાવના કરવાની કેવી લાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાડકો જાહી શકેશે. જૈન સંધમાં આ બનાવથી ચોમેર આનંદ ફેલાયો. દેશપરદેશમાં વીજળીના વેગે આ સમાચારો ફરી વળ્યા. હિંદુભરમાં શ્રીશોભનમુનિનું નામ વધારે મશાહૂર અને ગ્રલાવિક બન્યું.

સિદ્ધસારસ્વતકવિ ધનપાળનું જીવન દ્વિવસે દ્વિવસે વધારે ધાર્મિક થતું ગયું. તે શ્રીષ્ટી શુદ્ધ શ્રાવક-ધનપાળનો ટૂંકું ધર્મને પાળવા લાગ્યો. તેણે રાજ લોજને પરિચય. સમજવી માલવામાં જૈન સાધુનો વિહાર થ્યો કરાવ્યો. કલ્યાણા શક્તિ અને શખ્દાર્થની પ્રૌઢતામાં કાદંભરીને પણ ટક્કર મારે તેવી નવ રસથી પૂર્ણ ‘તિલકમંજરી’ નામની જૈન આખ્યાયિકા (કથા) બનાવી તેણે જૈન સાહિત્ય અને પોતાના જીવનને યશસ્વી કર્યાં. તે ઉપરાંત સત્યપુરીય મહાવીરોત્સાહ, વીરસ્તવ, પાદ્યલંઘીનામમાળા, કદ્ધલપંચાશિકા અને સાવર્યાવેહી વિગેરે અંથી પણ ધનપાળ કવિએ બનાવ્યા કે જે સંસ્કૃત પ્રાકૃતના સાહિત્યમાં આજે પણ ઊચું સ્થાન લોગવે છે. તેના સમયમાં ધનપાળ, એક મહાકાળ અને પ્રચંડ પંડિત તરીકે મનાતો હતો. કૈલક-વિદ્યમં વિગેરે પંડિતોને તેણે પરાસ્ત કર્યા હતા.

મુંજરાજ તેને પુત્ર તરીકે માનતો. અને લોજરાજ તો તેનો ખાસ મિત્ર અને મહેરભાન હતો. સરસ્વતીનું ટાઈટલ તેને મુંજરાજ તરફથી મળ્યું હતું. (જુઓ તિ. મં. ૫૩) સર્વત્ત્રસ્વતંત્ર સર્વશાસ્ત્રપારંગત શ્રીહૈમચંદ્રાચાર્ય જેવાએ પણ ધનપાળની બનાવેલી કવિતાથી જૈનમંદિરમાં જિને-શરની બહુમાનપૂર્વક સ્તવના^૧ કરી હતી. ‘હૈમકોષ^૨’ ‘હૈમકાવ્યાનુશાસન^૩’ અને ‘હૈમછન્દોનુશાસન^૪’ની વૃત્તિમાં

૧ કુમારપાળ પ્રાણધમાં-હેમાચાર્યે ધનપાળની બનાવેલ રતુતિ ઐલ્યાનો ઉદ્દેશ છે.

૨ “xxx વ્યુત્પત્તિર્ધનપાલતः” | xxx હૈમકોષની સ્વોપ્ન દીક્ઠા.

૩ હૈમકાવ્યાનુશાસનના “અર્થમેદભિજ્ઞાનાં ભજ્ઞાડભજ્ઞાભ્યાં યુગપદુક્તિઃ શ્લેષः” સૂત્રની સ્વોપ્નવૃત્તિ (અધ્યાત્મ ૫, પેજ ૨૩૧ નિર્ણય સાગરની આવૃત્તિ)^૫ અને તિલકમંજરીની ભૂમિકાના “પ્રાણ્યપ્રભાવઃ પ્રભવો” બીજ પદને ઉદ્ઘાટણ તરીકે ટાંક્યું છે.

૪ હૈમચ્છન્દોનુશાસનના પાંચમા અધ્યાયના સોલમા “પ્રાચદાચિ...”

પણ ધનપાળ અને તેની કવિતાનો ઉલ્લેખ મળી આવે છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ દ્વારા સર્વયકૃત્વી, આદર્શ કવિ તથા સમર્થ વિદ્ધાનું હતો. ‘મવિયસત્તકહા’ ને કર્તાં ધનપાળ; આ ધનપાળથી જુદ્દો છે. અન્યાન્ય અંથેમાં ધનપાળનું જીવન લાંબું અને ધણું રસિક છે, પણ આ સ્થળે અપ્રસ્તુત હોવાથી મને લગ્નવાની જરૂર જણ્ણાતી નથી. પાડકો અહીં તો આટલાથી જ સંતોષ માની દેશે એવી આશા રાખું છું. અસ્તુ.

હવે આપણે કરી પ્રસ્તુત વાત ઉપર આવીશું. શોભન-
મુનિના મહાનું પ્રયત્નથી આપણા માળવામાં
માળવામાં જૈન જૈન સાધુઓના સમૂહો વિચરવા લાગ્યા.
સાધુઓ. માળવાના જૈનોમાં નવું જીવન આવ્યું. ડેર
ડેર ધાર્મિક ઉત્સવો થવા લાગ્યા. સંઘની
વિનિથી શોભનમુનિના શુરૂ ધારાનગરીમાં પદ્ધાર્ય. શિષ્યના

(૫-૧૬) સૂત્રની સ્વોપ્નજ્ઞવૃત્તિમાં (શ્રી આનંદસાગરજી સંપાદિત આવૃત્તિ ૫૦ ૩૬ માં) નિલકમંજરી (પૃ. ૧૭૭) તું “ શુષ્કશિખરિણ કલ્પદાખીવ.....” પદ મળી આવે છે.

તિલકમંજરી ઉપર શાંતસૂર્યિંગ્રે વિકભની ૧૧ મી સદીમાં દિપખુ રચ્યું. પાઠથુના પહ્લિવાલ ધનપાલે વિ. સં. ૧૨૬૦ માં તિ. મં. નો સાર પદમાં ઉત્તારો. લક્ષ્મીધર પંચે વિ. સં. ૧૨૮૧ માં એક ઝીલે સાર ૧૧૮૮ અનુષ્ટુપ્ શ્રોડેમાં “નાનાયો છે. (છપાઈ ગેયો છે). અદારમી સદીમાં પદ્મસાગરગણિંગ્રે નિ. મં. ઉપર વૃત્તિ અને વીસમી સદીમાં ૫. લાખ્યાયનિયાયજીજુએ ગીણા બનાની છે. વિશેષ માટે જુઓ શ્રી જિલ વિ. નો ‘નિલકમંજરી’ દેખ.

મહાકવિ ધનપાળ માટે મેરેતુંગાર્ય કહે છે: —

“ વચન ધનપાલસ્ય ચન્દન મલયસ્ય ચ ।

સરસ હૃદિ વિન્યસ્ય કોડમૂજ્ઞામ ન નિર્વિત: ? || ૧ || ”

—પ્રભુંધયિતામણિ પૃષ્ઠ ૪૨.

૧ પ્રાચીન ધારા અને ત્યાંના સ્થાનો વિષે માલિતી માટે જુઓ
ધર્માસ્તકૃત્યાના જુનના ‘શારદા’ના અંકમાં જ્યાએલ “ લોજરાજની
ધારા નગરી ” નામનો મહારો દેખ.

પ્રયાસની થચેલી સફળતા અને સર્વત્ર ફેલાયલી શિષ્યની ડીચિને જોઈ ગુરુના આનંદનો પાર રહ્યો નહિ. ધનપાળે પેતાના ખર્ચે ધારામાં ક્રિષ્ટલદેવનું જૈનમંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શોભન-મુનિ અને તેમના ગુરુ પાસે કરાવી. માળવામાં ખીજાં પણ અનેક ધાર્મિક કાર્યો કરી શોભનમુનિએ ગુરુ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો.

**સંસ્કારી કુદુંખમાં જન્મયા હેઠાથી અને ચોગ્ય ગુરુના સમા-
ગમથી શોભનમુનિમાં ઊંચા પ્રકારનું વ્યક્તિ-
શોભનમુનિનું ત્વ પ્રગટયું હતું. તેમના વ્યક્તિત્વ માટે
વ્યક્તિત્વ.**

ધનપાળ કહિ ‘ચતુર્વિંશતિકા’ની દીકામાં લખે છે કે:-‘ શરીરથી ઢૂપાળો, ગુણુથી ઉજવલ, સુંદર નેત્રોવાળો શોભન નામનો સર્વદૈવને પુત્ર હતો; કે જે કાતંત્ર વ્યાકરણુનાં ગૂઠ તત્વોનો જાણુકાર હતો, જૈન ઔદ્ઘ્રતામાં નિષ્ણાત હતો અને સાહિત્ય શાસ્ત્રનો અઠંગ વિકાન્હેાઠ, કવિઓને માટે ઉદાહરણુભૂત હતો.^૧ કુમારાવસ્થામાં જ શોભને કામને પરાસ્ત કર્યો, પાપના વ્યાપારનો ત્યાગ કર્યો અને અહિંસા ધર્મને સારી પેઠે પાલન કર્યો હતો.’

**શોભનમુનિની જુદ્ધિ તીક્ષ્ણ હતી. લાવના ઉદાત હતી. જીવન
ભવ્ય અને રસિક હતું. કાંય સાહિત્યમાં તો
શોભનમુનિની તેઓ ધણા જ આરપાર ઉતરી ગયા હતા.
કૃતિ.**

તેના ઇલ સ્વરૂપમાં તેઓએ ‘મવ્યામ્ભોજવિબોધ-
નૈકતરણો !’ થી શરૂ થતી ૬૬ લોકની ન્હાની
પણ વિવિધ જલના. અલંકારોથી પૂર્ણ ચમત્કાર વાળી એક કૃતિ
ળનાવી. આમાં પ્રત્યેક તીર્થકર, (ચોવીસે તીર્થંકર) જૈનાગમ અને
સોળ વિદ્યાહેવીઓ વિગેરેનું કાંયની પદ્ધતિથી વર્ણાન છે. આ
કૃતિની અંદર શાખાલંકાર, અને તેમાંય ખાસ કરીને
‘યમક’ અને ‘અનુપ્રાસ’ ની અનેરી છટા જોવામાં

૧ “ કાતન્ત્રતન્ત્રોદિતતત્ત્વવેદી યો બુદ્ધચૌદ્ધાર્દહતતત્ત્વતત્ત્વતત્ત્વः ।

સાહિત્યવિદ્યાર્થીવપારદર્શો નિર્દીશને કાવ્યકૃતાં બમૂવ ॥ ૪ ॥

શોભન સ્તુતિની ધનપાલ કૃત દીકાના ૧ થી ૭ સુધી લોકો ઉપગોળી છે.

આવે છે. કોઈ ઠેકાળે મધ્યાનત યમક, કોઈ સ્થળે આદિમધ્ય યમક (મધ્યાનત યમકની સાથે), કોઈ જગ્યાએ આધ્યાત્મિક, કોઈ પદમાં સંચુતાવૃત્તિ યમક અને કોઈ સ્થળે અસંચુતાવૃત્તિ યમક વિગેરે અલંકારો ગોડંયા છે.^૧

આ કૃતિમાં નહાના મોટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છેંદો છે કે જે વિક્રાનોને જ્ઞાન અને આનંદ ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકારો અને છેંદોમાં પોતાના લાવો ગોઠવવા તે ક્રિટલી મુરકેલની વાત છે તે કવિતા ખનાવનાર જ સમજી શકે તેમ છે. આ અંથ ખનાવતી વખતે શોલનમુનિનું ચિત્ત કેવું એકાથ ખન્યું હતું ? તેનું એક ઉદાહરણું પ્રલાવક ચરિત્રમાં મળે છે. જ્યારે શોલનમુનિ પ્રસ્તુત 'જિન સ્તુતિ ચતુર્વિશતિકા' ખનાવતા હતા, તે અરસામાં તેઓ જૈયરી (લિક્ષા) લેવા ગયા. ચાલતાં ચાલતાં પણું પ્રસ્તુત કૃતિ ખનાવવાની એકાથતામાં તેમનું ચિત્ત પરોવાએલું હતું, તેથી ખ્યાલ નહિ રહેવાથી તેઓ એક જ શ્રાવકના ઘરે ત્રણુવાર ફરી ફરી જૈયરી ગયા. જ્યારે શ્રાવિકાએ શોલનમુનિને પૂછ્યું કે, 'આમ ફરી ફરી જૈયરી આવવાનું શું કારણ ?' ઉત્તરમાં શોલનમુનિએ કહ્યું કે:- 'અત્યારે કવિતા ખનાવવામાં જ મારું મન પરોવાએલું છે તેથી મને ખઅર ન રહી કે હું કેને ત્યાં જઈ છું અને શું કરું છું ?' પૂછ્યાર બાઈએ શોલનમુનિના ગુરુની આગળ પણું આ વાત કહી. ગુરુ આ વાતથી ધણ્ણા જ રાજી થયા અને શિષ્યની જ્ઞાનરસિકતાથી સંતોષ પામી તેમણે શોલન મુનિનાં વખાણું કર્યાં.^૨ શોલનમુનિને કવિતા ખનાવવાનો કેવો રસ હુતો તે આ એક જ પ્રસંગથી વાચકો જાણ્ણી શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષણી ધણ્ણા લોકો આ સ્તુતિ-'થોય' ને પ્રતિકમણુંદિ કિયાએમાં ભોવે છે. પાદ્ધક આદિ પ્રતિકમણોમાં આ પવિત્ર વિક્રાનતી થોય દાખલ કરાય તો કેવું સારું-થાય ?

૧ આ વધા યમકોનાં લક્ષણો અને ઉદાહરણો વાગ્યાલંકાર, સરસ્વતીકંઠાલરણું વિગેરે અન્યોમાં છે.

૨ જુઓ મહેન્દ્રસુરિ ચરિત્ર. (પ્રભાવક ચરિત્રમાં).

હુનિયામાં વિક્રાનો અને સજજનો કોઈ કોઈ વાર જલ્દીથી જગતને છોડી ચાલ્યા જાય છે. શોભનમુનિ શોભનમુનિનું માટે પણ તેમજ થયું !. તેમને તાવનો લયંકર અવસાન. જીવલેણુ રૈગ લાગુ પહ્યો, તેના પરિણામે ચુવા-વસ્થામાં તરત જ તેઓ મર્ત્ય (મનુષ્ય) લોકને

છોડી અમર્ત્ય લોક (સૌધર્મહેવલોક) ના અતિથિ થયા-સ્વર્ગવાસી થયા. હુર્ભાગે તેમનું આ મરણું શા કારણુથી, કચે સ્થળે અને કચે દિવસે થયું ? તે જાણુવાનું ચોક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, પણ શ્રીમાન् જિનવિજ્યજી સંપાદિત પ્ર૦ ચિં૦ ની આવૃત્તિના ‘લોજલીમ પ્રબંધ’ માં પાડ છે કે:- ‘શોભનમુનિ; સ્તુતિ કરવાના ધ્યાનની એકાશતાથી એક ખાઈને ત્યાં ત્રણુવાર (ગૌચરી માટે) જવાથી તે ખાઈની નજર લાગી અને તેથી શોભનમુનિ કાઢી કરી ગયા-સ્વર્ગવાસી થયા.’^૧ મને લાગે છે કે જે ખાઈને ત્યાં ત્રણુવાર ગૌચરી જવાનું પ્રલાવક ચરિત્રના મતથી હું ઉપર લખી ગયો છું તેજ ખાઈની કદાચ શ્રી શોભનમુનિને નજર લાગી હુશે. આવા કારણુથી સાધુનું મૃત્યુ થાય તેવા દાખલાઓ બહુજ વિરલ બને છે, પણ આમાં એ ઐતિહાસિક અંશોના પાડો છે એટલે આ વાતને આપણે જુહી કહેવાનું સાહસ તો નજ કરી શકીએ. ઉપર્યુક્ત કારણુથી તેઓ ગુજરાતમાં ધણુ લાગે (પાઠણુમાં ?) લગભગ ત્રીશાથી ચાળીશ વર્ષની ઉમરમાં અકાણે સ્વર્ગવાસી થયા હશે ? એમ મારું અનુમાન છે.

સાહિત્ય દિલ્લિએ મહીાનું શક્તિ ધરાવનાર, અનેક અંશો લખવાની અને શાસનની સેવા કરવાની ઉદ્દાત ભાવનાવાળા આ તરણુમુનિ જે વધુ જીવ્યા હોત તો કાબ્ય અને અદ્વાંકરના અનેક મૈલ્દિક અંશોનો જૈન સમાજને વારસો આપી

૧ ઇતશ્ર શોભન: સ્તુતિકરણધ્યાનાદ એકસ્યા ગૃહે ત્રિગ્રમનાત્ તસ્યા દૃષ્ટિદોષાદ્ મૃતઃ । પ્રાન્તે નિજશ્રાતુઃ પાર્શ્વત સ્તુતીનાં વૃત્તિં કારયિતા અનશનાત્ સૌધર્મે ગતઃ । પ્રબંધચિન્તામણિ પૃ. ૪૨.

શક્યા હોત, પણ કમનસીએ તેમ ન બન્યું ! ઇક્તા તેમની પ્રસ્તુત કૃતિ ‘જિન સ્તુતિ ચતુર્વિશાંતકા’ નામની એકજ કૃતિ આજના જૈન સમાજને વારસામાં મળી છે. જે કે તેમની આ એક કૃતિ પણ તેમના ઉદ્ઘૂરલ થશને કરનારી છે એમાં તો કોઈ જતનો શક નથી.

ઐતિહાસિક આલોચના.

પહેલાં હું લખી ગયો છું તેમ શ્રી શોભન મુનિના ગામ, ગુરુ, વિગેરેની બાખતોમાં અનેક અંથકારોના મતલેદો છે, તેમાં સુખ્ય આ છે—

મતલેદનું કોષ્ટક.

અંથનું નામ.	અંથકાર.	શોભનનું ગામ.	શોભનના પિતા.	શોભનના ગુરુ.
લિલકમંજરી	કવિ ધનપાલ	ધારા	સર્વદેવ	
સ્તુતિ ચતુર્વિશાંતકાની ટીકા	”	”	”	
પ્રલાઘક ચરિત્ર	પ્રલાઘદ્રસ્ફુરિ	”	”	મહેન્દ્રસ્ફુરિ
ઉપરેશપ્રાસાદ	વિજયલક્ષ્મીસ્ફુરિ	”	લક્ષ્મીધર	
ઉપરેશકલ્પવલિ	”	”		
સમ્યક્તવસમતિક	સંધતિકસ્ફુરિ	ઉજનૈન	સોમચંદ્ર	જિનનેશરસ્ફુરિ
આતમપ્રાધ	જિનલાભસ્ફુરિ	આવન્તી	સવ ધર	
પ્રભાધયિંતામણુ	મેરતુંગસ્ફુરિ	વિશાલા	સર્વદેવ	વર્ધમાનસ્ફુરિ

ઉપર લખેલા આડ અંથોમાં શોભનના ગામવિષે ચાર મત, પિતા વિષે ચાર, અને શોભનના દીક્ષા ગુરુ વિષે ત્રણ મત થવા પાર્યા છે. આમાં કયો મત સાચો ? એ પ્રશ્ન ધણો ગુંચવણું ભરેલો છે. શ્રીયુત પ્રો. ડીરાલાલ. આર. કાપડીયાંને ‘શોભનસ્તુતિ’ અને તેની ધણી ટીકાઓના સંપાદન ઉપરાંત આ અંથનું ધણું

લાંબું ગુજરાતી લાખાન્તર કર્યું છે. લાંબાણુથી પ્રસ્તાવના લખવા છતાં શોલન મુનિના જીવન વિષે કોઈ પણ જાતનો નિર્ણય તેમણે કર્યો નથી. હું નથી સમજી શકતો કે આટલા મોટા પુસ્તકમાં તેઓએ શોલનના વિષયમાં મહત્વતું કેમ નથી લખ્યું? અસ્તુ.

નેકે અત્યારે વિસ્તારથી હું લખવા એઠો નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થાડી વિચારણા કરવા યત્ન કરું છું.

ઉપરના કોષ્ટકથી જણાય છે કે જુદા જુદા અંશોમાં શોલનના પિતા સર્વદેવની નગરીનાં ધારા, ઉજ્જગામની પરીક્ષા. યિની, અવન્તિ અને વિશાલા એમ ચાર નામો લખ્યાં છે.

આચાર્ય શ્રીહેમયંદ્રના અભિધાનચિંતામણિ કોષમાં અવન્તિ, વિશાલા અને પુષ્પકરંડિની આ ત્રણે ઉજ્જગયિની (ઉજ્જનૈન) ના પચાર્ય^૧ શખ્ષે લખ્યા છે. આનાથી આટલો ખુલાસો તો થઈ જય છે કે, ^૨અવન્તિ અને વિશાલા આ એ ઉજ્જનૈનનાં અપર (પર્યાય) નામો છે. હવે શોલનની નગરી વિષે; ધારા (ધાર) અને ઉજ્જનૈન આ એ મત રહ્યા. ધારાના મતમાં પાંચ અંશો છે જ્યારે ઉજ્જનૈનના મતમાં ત્રણ અંશો છે. આ એ મંતલેદ ધરાવનાર અંશોમાં એક બાળું પ્રભાવકુચિત્ર, તિલકમંજરી, શોલનસ્તુતિટીકા જેવા અંશો છે અને બીજું બાળું પ્રથાંધચિંતામણિ છે. પ્રથાંધ ચિંતામણિના ઉદ્દેખને પ્રમાણું વગર વખ્તાડી પણ કઢાય નહિ, તેથી મારો મત તો એવો છે કે ‘પરમાર વંશીય રાજ મુંજ ઉજ્જનૈનમાં રાજ્યધાની રાખી માળવાનું રાજ્ય કરતો હતો, તેના ઉત્તરાધિકારી લોકે પણ

૧ “ ઉજ્જયિની સ્યાદ વિશાલાડવન્તી પુષ્પકરણિની ॥

અભિધાનચિંતામણિ ” ૪-૪૨

૨ હૃસ્તધકારાનત અવન્તિ શખ્ષ માત્રવાદેશનો વાચક છે, જુઓ
હૈમકોષમાં (૪-૨૨).

ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણ ગુજરાત તરફના રાજાઓનાં આકમણો તે વખતે અવારનવાર થયાં કરતાં હતાં,^૧ તેથી રખેને ગુજરાતથી ઢાંડાં, ગોધરા, રાજગઢ, અને ધારાના રસ્તે થઈ ગુજરાતના રાજ માળવા ઉપર ચંદાઈ કરી આવે? એવી આશાંકાથી લોજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દક્ષતર ત્યાં આણ્યાં હોય? એટલે કે ધારાનગરીને રાજધાની કરી ત્યાં વધુ વખત લોજ રહેવા લાગ્યો હશે.' તે પછીના ઉલ્લેખોમાં લોજ રધારાધીશ-ધારાપતિ તરીકે ઓળખાય છે.

જ્યારે રાજ લોજ ઉજનૈનથી ધારા રહેવા ગયો તો તેના આશ્રિત પંડિતોએ પણ ત્યાંજ (ધારામાં) રહેવું જેધાએ; એટલે ધનપાલ, અને શોલનના પિતા પંડેલાં ઉજનૈન રહેતા હશે? અને પાછળથી રાજ લોજની સાથે પોતાના પુત્રો ધનપાલ અને શોલનને લઈને તેઓ ધારામાં રહેવા ગયા હશે.^૩ એ હિસાએ ઉજનૈન અને ધારા આ બન્ને નગરીમાં ધનપાળ તથા શોલન રહ્યા હતા એમ માનવામાં કશો બાધ નથી. મારા આ મતથી પ્રભાવક ચરિત્ર અને પ્રભંધ-ચિંતામણિ વિગેરે અંથોના ઉલ્લેખોનો પણ સમન્વય થઈ શકે છે. પ્રભંધચિંતામણિમાં પૂર્વકાલની દાખિએ વિશાળા

૧ જુઓ પ્રભંધચિંતામણિનો લોજલીમ પ્રભંધ.

૨ જુઓ સરસ્વતી કંદાલરણુની પ્રતાવના તથા તિલકમંજરીની પ્રતાવના. બોજનો રાન્યકાલ વિક્રમ સં. ૧૦૬૭ થી ૧૧૧૧ સુધી છે.

૩ બોજની રાજધાની ધારા (ધાર) માં હતી તે વિષે શાંતિસુરિ-ચરિત્ર, મહેન્દ્રસુરિચરિત્ર, સરાચાર્યચરિત્ર, અભયદેવસુરિચરિત્ર, બિલખણુકવિનું વિક્રમાંકદેવચરિત્ર, બોજલીમ પ્રભંધ, પાધચલચ્છીનામમાળા, સરસ્વતી કંદાલરણુ, પ્રમેયકમલમાર્ત્રણી પ્રતાવના, રાજવંશાવલી અને હિંદુતાની ત્રૈમાસિક વિગેરે અંથો જેવા. વિસ્તારના ભયથી હું અહીં વધુ વિચાર કરતો નથી, તથા તે તે અંથોના પાઠો આપતો નથી.

(ઉજણૈની)નો^૧ અને પ્રલાવકચરિત્રાદિમાં ઉત્તરકાળની દસ્તિઓ ધારાને ઉલ્લેખ છે એમ જણાય છે.

શોભનને માટે ઉલ્લેખ કરનારા ને ને થંચો છે, તેમાં જૂનામાં જૂના અંથો-શોભનના સગાલાઈ કવિ ધન-શોભનના પિતા. પાલની તિલકમંજરી, શોભનસ્તુતિચ-તુર્વિંશતિકાની ગીતા, પ્રલાચંદ્રકૃત પ્રલાવક-ચરિત્ર અને પ્રથમંધ્ય ચિંતામણી જેવા ઐતિહાસિક થંચો છે. તે બધામાં શોભનના પિતાનું નામ ‘સર્વહેવ’ લખ્યું છે. સર્વહેવ નામ સિવાય બીજા નામવાળા થંચો ધણું અર્વા-ચીન અને ઐતિહાસિક દસ્તિઓ મહત્વના નહિ હોવાથી તેમાં લખેલાં બીજાં નામો વિદ્યસનીય નથી. વળી ઉપરેશ પ્રાસાદમાં શોભનના પિતાનું નામ લક્ષ્મીધર લખ્યું છે તો તે બ્રાન્નિતિમૂલક છે.

૧ શરૂઆતમાં પ્રથમંધ્ય ચિંતામણિકાર ‘પુરાસમૃદ્ધિશાલાયાં વિશાલાયાં પુરિ’ કષી સર્વહેવની નિવાસ નગરી ઉજણૈન બતાવે છે; પણ જ્યારે શોભનમુનિ વિદ્ધાન થધ ઇરી માલવામાં પોતાના ભાઇને પ્રતિશોધવા આવ્યા છે ત્યારે તેએ ધારાનગરીમાં આવ્યા છે એવો ઉલ્લેખ કરે છે. નેમઃ— “ અભ્યસ્તસમસ્તવિદ્યાસ્થાનેન ધનપાલેન શ્રીમોજપ્રસાદસમ્પ્રાસસમસ્તપણ્ડિત-પ્રષ્ટપ્રતિષ્ઠેન નિજસહોદરાર્મષભાવાદ દ્વારદ્વાર્દ્વી યાવત્ સ્વદેશો નિષિદ્ધજૈનદર્શન-પ્રવેશેન તહેશોપાસકૈરત્યર્થમભ્રયનયા ગુરુષ્વાદ્યમાનેષુ સકલસિદ્ધાન્તપારાવાર-પારદ્વશ્વા સ ‘ શોમનનામા ’ તપોધનો ગુરુનાષ્ટચછ્ય તત્ત્વ પ્રયાતો ધારાયાં પ્રવિશન્ત પણ્ડિતધનપાલેન રાજપાટિકાયાં બ્રજતા તં સહોદરમિત્યનુપલક્ષ્ય સોપહાસં ગર્દભદન્ત ! ભદન્ત ! નમસ્તે ઇતિ પ્રોક્તે ”...પ્રથમંધ્યચિંતામણિ (જિનવિજયળ સંપાદિત) પૃ. ૩૬.

આનાથી પણ મહારી કુદ્ધના મજબૂત થાય છે કે:—શોભન વિગેરે પહેલાં ઉજણૈનમાં રહેતા હતા અને પાછળથી ધારામાં રહેવા આવ્યા. આમ માન-વાથી બન્ને ભતોનો સમન્વય પણ થાય છે.

શોભન મુનિના શુરુ તરીકે ત્રણુનાં નામો કોષ્ટકમાં દેખાય છે.

એક તો મહેન્દ્રસૂરિ, યીજા વર્ધમાનસૂરિ

શોભન મુનિના અને ગીજ જિનેશ્વરસૂરિ. ધનપાલ કવિઓ

ગુરુ. સ્પષ્ટ રીતે એ ઉદ્દેખ કર્યો નથી કે સર્વહેવને

નિધિ કોણે ખતાવ્યો, તેની શક્ષા ક્યા આચાર્ય

ઉપર થથ અને શોભને દીક્ષા કોણી પાસે લીધી ? અત્યારે તો શોભનના વિષે વિગતવાર જૂનામાં જૂને ઉદ્દેખ પ્રલાવકુદ્ધરિત્રમાં મળે છે. ૧તેમાં લખ્યું છે કે-શોભન મુનિના શુરુ મહેન્દ્રસૂરિ હતા. આ આચાર્ય પાસેથી જ શોભનના પિતાએ નિધાનનું સ્થાન જાણ્યું, ધર્મ પામ્યો અને આમનો જ પોતાનો શોભન નામનો પુત્ર દીક્ષા આપવા સોંઘ્યો. આ વાતને પ્રમાણિત કરવા માટે સૂચના-રૂપે સાધન તિલકમંજરી છે, કે ને શોભનના સગાલાઈ કવિ ધનપાળે બનાવી છે. તેણે તિલકમંજરીની પીડિકામાં ઈન્દ્રભૂતિ, વ્યાસ વાદિમકાદિ કવિઓની સ્તુતિ કરી શ્રી મહેન્દ્રસૂરિની પણ સ્તુતિ કરી છે. ૨ પોતાના સમયમાં શાંતિસૂરિ, સૂરાચાર્ય, અલયહેવસૂરિ, વર્ધમાનસૂરિ વિષે અનેક વિદ્ધાન જૈનાચાર્યોની હસ્તી હોવા છતાં તેમની સ્તુતિ નહિ કરતાં આ આચાર્યની જ સ્તુતિ કરવામાં ધનપાલનો તેમના ઉપર દ્દે ધર્મરાગ અને શોભનના શુરુ તરીકેનો સંબંધ હોય એ કલ્પના સહેજે કરી શકાય છે. શોભનના શુરુ આ મહેન્દ્રસૂરિ; કોના શિષ્ય હતા ? કોણી પરંપરામાં થયા ? એમણે કયા અને કેટલા થંધો લખ્યા ? તે વિષે હજી સુધી કાંઈપણ જણાયું નથી. પ્રલાવકુદ્ધરિત્રમાં મહેન્દ્રસૂરિનો પ્રબંધ છે; તેનાથી તેઓ યાંદ્રગચ્છના વિદ્ધાન આચાર્ય હતા એટલું જણાય છે.^૩

૧ જુઓ પ્રભાનક ચરિત્રમાં મહેન્દ્રસૂરિ ચરિત્ર.

૨ “ સૂરિમહેન્દ્ર એવૈકો વૈબુધારાધિતકમः ।

યસ્યામત્યોચ્ચિતપ્રૌઢિ કવિવિસ્મયકૃદ વચः ” ॥ તિલકમંજરી ૩૪.

૩ તત્ત્વાન્યદાયયૌ ચાન્દ્રગચ્છપુષ્કરમાસ્કરઃ ।

શ્રીમહેન્દ્રપ્રમુઃ પારદ્વા શ્રુતપયોનિષે: ॥ મહેન્દ્રસૂરિચરિત્ર શ્લોક ૧૨.

શોભનમુનિના ગુરુ વિષે ખીજે ઉલ્લેખ ‘પ્રભંધચિંતામણિ’ માં છે, તેમાં શોભનના ગુરુ શ્રી વર્ધ્માનસૂરિ લખ્યા છે, અને ખીજે ઉલ્લેખ ‘સમ્યકૃત સસતિકાઈકા’ નો છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ જણાયા છે.

એ વાત તો નક્કી છે કે:—શોભનના સમયમાં શ્રી વર્ધ્માનસૂરિ વિદ્યમાન હતા. તેઓ ઉધોતનસૂરિના ઉત્તરાધિકારી તરફે લગ્નાનું મહાવીરની ઉદ્દેશ્ય પાટે એડા હતા, અને તેમના શિષ્ય જિનેશ્વરસૂરિ જી માં પાટે થયા, એમ ‘જૂની પદ્માવલિયોથી જણાય છે. પ્રભંધચિંતામણિ જેવા અંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગણુના તો ન જ કરી શકીએ; તેથી એમ કદ્યપના થાય છે કે, શ્રી વર્ધ્માનસૂરિ સાથે પણ સર્વદૈવનો પહેલાં સંખંધ જોડાયો હુશે? સર્વદૈવ સાધુલક્ષ્ણ હતા, એટલે આ આચાર્યથી પણ તેણે કંઈક લાલ મેળંયો હુશે? અને મહેન્દ્રસૂરિ સાથે પાછળથી સંખંધ જોડાઈ વધ્યો હુશે. અથવા વર્ધ્માનસૂરિ પાસે શોભનમુનિએ થોડું ઘણું અધ્યયન કર્યું હુશે તેથી વર્ધ્માનસૂરિના ઉલ્લેખમાં કંઈક સત્યતા જણાય છે. જ્યારે વર્ધ્માનસૂરિનો ઉલ્લેખ શક્ય લાગે છે તો તેમના શિષ્ય જિનેશ્વરસૂરિનો ઉલ્લેખ ગુરુના સંખંધથી પાછળના અંશોમાં થવો સંસ્કૃતિ છે. ઘણું અંથકારો આવી ભૂત સહેજે કરી એસે છે એટલે ‘સમ્યકૃત સસતિકા’ નો ઉલ્લેખ તેવો જ હુશે? એ બધું વિચારતાં શોભનના દીક્ષાગુરુ તો મહેન્દ્રસૂરિ જ હોવા જોઈએ; એમ મહારી કદ્યપના છે. મતલખ કે તિલકમંજરીનો સંવાદ હોવાથી અને પ્રભાવકૃચારિત્ર, એ પ્રભંધચિંતામણિ વિગેરે કરતાં વધુ પ્રામાણિક તથા જૂનું હોવાથી શોભનમુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે ચોગ્ય છે.

૧ જુએ ‘ભરતરગચ્છપદ્માવલિસંગ્રહ’ ૫૦ ૨૦ (શ્રીજિનવિજ્યજાસંપાદિત).

શોલનના દાદાનું નામ ‘દેવર્ષિ’ હતું, જેએ મહોટા દાની અને પંડિત તથા જાતથી પ્રાક્ષણ્ય હતા. શોલનનું ગૃહસ્થ તેમના પુત્ર ‘સર્વદેવ’ થયા, તેએ વિદ્ધાનું કુદુંખ. કલાપ્રિય અને મહાકવિ હતા. સર્વદેવ; શોલન-મુનિના પિતા થતા હતા. મહાકવિ ‘ધનપાદ’ શોલનનો મહોટા લાઈ હતો. તેમની ‘સુંદરી’ નામના એક બહેન હતી કે જેને માટે કુવિ ધનપાળે વિકભ સંં ૧૦૨૬માં ‘પાદઅલચ્છીનામમાલા’ (કોશ) ^૨ બનાવી છે, એમ તે અંથની પ્રશસ્તિથી જણાય છે. શોલનનું કુદુંખ લાંખાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતું.

શોલનના દાદા ‘સાંકાશ્ય’ નગરના હતા. આ નગર પૂર્વ-દેશમાં છે. અત્યારે ફ્રેક્ચરાબાદ જિલ્લામાં ‘સાંકિસ’ નામના ગામથી તે પ્રસિદ્ધ છે.^૩ સર્વદેવ વ્યવસાય-આજીવિકા માટે માલવાની રાજધાની ઉજ્જ્વલિની (ઉજ્જીવન)માં આવી રહ્યા હતા. પાછળના સમયમાં જ્યારે લોને ધારા (ધાર)માં સ્થિરતા કરવા માંડી ત્યારે તે ધારામાં રહેવા આવ્યા.

શોલનમુનિની પ્રસ્તુત કૃતિ બહુ જૂની છે. જૈનો અને વૈદિકામાં ધમકાદિ શણદાલંકારથી છઢકાતી શોલનસ્તુતિ- આટલો જૂની કૃતિએ બહુ જ ઓછી મળે છે. અતુર્વિંશતિકાની- શોલન સ્તુતિની અસર તે પણીના ધણ્ણા કવિ ટીકાએ. વિદ્ધાનો ઉપર થઈ છે. મહાકવિ વાગ્ભાગ, અમર-

૧ અલબ્દદેવર્ષિરિતિ પ્રસિદ્ધ યો દાનવર્ષિતવિભૂષિતોડપિ... ।

તિલકમંજરી શ્લોક ૫૧.

૨ અત્યારસુધી મળેલા પ્રાકૃતકોણોમાં આ જૂનામાં જૂનો પ્રાકૃતકોષ છે.

૩ જુએ ધનિયન હિસ્ટોરિકલ ક્વોટરલી ધરનીસન् ૧૮૨૮ પેજ ૧૪૨. ‘સિદ્ધહેમનંદશબ્દાનુશાસનની લધુરૂપી’ માં એક ઠેકાણે લખ્યું છે કે “સાઙ્કાશ્યકેભ્ય: પાટલિપુત્રકા આવ્યતરા:” (૭-૩-૬) નિજસંપાદિત આવૃત્તિના ૫૬૧ પેજમાં) આનાથી રૂપે જણાય છે કે સાંકાશ્ય જે કે પુનાથી ઉત્તરું પણ સમૃદ્ધ નગર હતું, તથા મધ્યહેશમાં પ્રસિદ્ધ હતું.

ચંદ્રસૂરિ, કીર્તિરાજેપાદ્યાય, મહામહોપાદ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની સેમનિર્વાણુ, નેમનાથ મહાકાળ્ય, ઔન્દ્રસ્તુતિ આદિ કૃતિઓએ શોભનસુનિકૃત પ્રસ્તુત કૃતિના અનુકરણ અથવા પ્રેરણાનું કેલ છે.

શોભનસ્તુતિમાં અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચારો અને કવિઓએ શોખ કે પરોપકારાર્થે તે ઉપર રીકાચો બનાવી છે. જેમાંની નવ ટીકા તો આજકાલ જાણીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્ત્વ ગંભીરતા અને પ્રસિદ્ધ સહેલે સમજી શકાય તેમ છે. તે ટીકાકારેનાં નામો આ છે:—

ધનપાલ, જયવિજયજી, રાજસુનિ, સૌભાગ્યસાગરસૂરિ, કનક-કુશલગણ્ય, સિદ્ધિચંદ્રગણ્ય, હેવચંદ્ર, અજણસાગર અને એક ધીજા અવચ્ચુર્ણિકાર પૂર્વાચાર્ય (આમના નામનો પત્તો મળ્યો નથી).

વીસમી સહીમાં પણ ડાકટર હરમન બાકોથી વિગેરે વિદ્ધાનોએ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તરો કર્યાં છે. જો. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિંશતિકાની અનેક ટીકાઓ સંપાદિત કરી છે. વિક્રમ સં ૧૬૭૫ મા શ્રીમાનુ અભિતસાગરસૂરિજી મહારાજે પણ ‘ સરલા ’ નામની ટીકા તથા ગુજરાતી ભાષાન્તર કરેલ છે. જે થોડા ટાઇમમાં બહાર પડશે.

‘ તારણુ. ’

આહી મહાકવિ શોભનસુનિની જીવનરેખા ટૂંકાણુમાં આવેખી છે. તેમનો સત્તા સમય ઈસ્વી ૧૧ મી સહીમાં છે. તેઓ જન્મથી પ્રાણણુ અને પાછળથી દીક્ષા લઈ જૈનશર્મણુ (સુનિ) થયા હતા. રાજા લોજ સાથે તેમના આખા કુદુંબનો ઘણો મીડો સંખંધ હતો.

શ્રી શોભનની સ્તુતિચતુર્વિંશતિકાનાં સુંદર તથા છટાવાળાં લક્ષિત લર્યાં ક્વનો કવિઓને પ્રસન્ન કરનારાં છે. લોકો આનો વધુ પ્રચાર કરી અંથકારને પણ ઓળખે એટલું ઈચ્છી આ નિખંધને અહીં પૂરો કરું છું.

શ્રી શોભનસુનિની કૃતિનાં વિશિષ્ટ પદો પરિશિષ્ટમાં આખ્યાં છે.

શ્રી શોભન સ્તુતિ ચતુર્વિંશતિકાનાં વિશિષ્ટ પદોએ.

—૨૫૯૮—

આ નિબંધમાં શ્રી શોભન મુનિની ઇતિ (સ્તુતિ ચતુર્વિંશતિકા) નો પણ પરિચય આપેલો છે. આનાં પદો ભક્તિ કાબ્ય અને અલંકારની દર્શિએ ચમતકારવાળાં છે. તેનો રસાસ્વાદ વાચેકો કરે તેવા આશયથી પ્રસ્તુત ઇતિ (શ્રીજિનસ્તુતિચતુર્વિંશતિકા) માંથી કાબ્યઅલંકાર તથા છંદની દર્શિએ મહત્વનાં ડેટલાંડ પદો ચુંગીને અને આપવામાં આવે છે.

(૧)

શ્રીક્રષ્ણભજિનસ્તુતિઃ ।

ભવ્યામ્ભોજવિબોધનૈકતરણે ! વિસ્તારિકર્માવલી-

રમ્ભાસામજ ! નાભિનન્દન ! મહાનષાપદાભાસુરૈઃ ।

ભર્ત્યા વન્દિતપાદપદ્મ ! વિદુષાં સંપાદય પ્રોજ્ઝિતા-

રમ્ભાસામ ! જનાભિનન્દન ! મહાન्, અષાપદાભાસુરૈઃ ॥ ૧ ॥

શાર્ડૂલવિક્રીડિતમ् ।

(૨)

શ્રીરોહિણીસ્તુતિઃ ।

વિશિખશર્ણુષા ધનુષાડસ્તસત-

સુરભિયા તતનુભ્રમહારિણા ।

પરિગતાં વિશદામિહ રોહિણી

સુરભિયાતતનું નમ હારિણા || ૧૬ ||

દુતવિલમ્બિતમ् ।

(૩)

સમસ્તજિનવરપ્રાર્થના ।

વિધુતારા ! વિધુતારાઃ !

સદા સવાના ! જિના ! જિતાઘાતાઘાઃ ।

तनुतापातनुतापा !

हितमाहितमानवनविभवा ! विभवाः ! ॥ १८ ॥

आर्यागीतिः ।

(४)

कालीदेवीस्तुतिः ।

नगदाऽमानगदा मा—

महो ! महोराजिराजितरसा तरसा ।

घनघनकाली काली

बतावतादूनदूनसत्रासत्रा

॥ २० ॥

आर्यागीतिः ।

(५)

श्रीसिद्धान्तस्वरूपम् ।

आन्तिच्छिदं जिनवरागममाश्रयार्थ—

माराममानम लसन्तमसङ्गमानाम् ।

धामाग्रिमं भवसरित्पतिसेतुमस्त—

माराममानमलसन्तमसं गमानाम् ॥ २३ ॥

वसन्ततिलका ।

(६)

श्रीजिनसमूहच्यानम् ।

ब्रजतु जिनततिः सा गोचरे (रं) चित्तवृत्तेः

सद्भरसहिताया बोधिका मानवानाम् ।

पदमुपरि दधाना वारिजानां व्यहारीत्

सद्भरसहिताया बोधिकामा नवानाम् ॥ २६ ॥

मालिनीछन्दः ।

(७)

सिद्धान्तस्तुतिः ।

सिद्धान्तः स्ताद् अहितहतयेऽख्यापयद् यं जिनेन्द्रः
 सद्राजीवः स कविधिषणापादनेऽकोपमानः ।
 दक्षः साक्षाच्छ्रवणचुलुकैर्यं च मोदाद् विहायः—
 सद्राजी वः सकविधिषणाऽपादनेकोपमानः ॥ ३१ ॥
 मन्दाकान्ता ।

(८)

श्रीजिनेन्द्राणां स्तुतिः ।

जिनवरततिर्जीवालीनामकारणवत्सलाऽ—
 समदमहिताऽमारा दिष्टासमानवराऽजया ।
 नमदमृतभुक्पङ्कत्या नूता तनोतु मर्ति ममाऽ—
 समदमहितामारादिष्टा समानवराजया ॥ ४२ ॥
 हरिणीछन्दः ।

(९)

जिनभारत्याः स्वरूपम् ।

नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तबन्धा—
 ऽपापायाऽसाद्यमानाऽमदन ! तव सुधासारहृद्या हितानि ।
 वाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियान् मे—
 ऽपापायासाद्यमानामदनत ! बसुधासार ! हृद्याहितानि ॥४७॥
 क्षग्धरावृत्तम् ।

(१०)

समस्तजिनवराणां स्तुतिः ।

सदानवसुराजिता असमरा जिमा भीरदाः
 क्रियासु रुचितासु ते सकलभारतीरा यताः ।

सदानवसुराजिता असमराजिनाभीरदा

क्रियासुरुचितासु ते सकलभा रतीरायताः ॥ ५० ॥

पृथ्वीछन्दः ।

(११)

श्रीचक्रधरायाः स्तुतिः ।

याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता हुतात्—

समतनुभागविकृतधीरसमदैरिव धामहारिभिः ।

तडिदिव भाति सान्ध्यघनमूर्धनि चक्रधराऽस्तु सा मुदेऽ—

समतनुभा गवि कृतधीरसमदैरिवधा महारिभिः ॥ ७२ ॥

द्विपदीछन्दः ।

(१२)

श्रीकपर्दियक्षराजस्मृतिः ।

द्विपं गतो हृदि रमतां दमश्रिया

प्रभाति मे चकितहरिद्विपं नगे ।

वटाहये कृतवसतिश्च यक्षराट्

प्रभातिमेचकितहरिद् विपन्नगे ॥ ७६ ॥

रुचिराछन्दः ।

(१३)

श्रीगोरीदेव्याः स्तुतिः ।

अधिगतगोधिका कनकरुक्रु तव गौर्युचिता—

झमलकराजि तामरसभास्यतुलोपकृतम् ।

मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती

कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥

तत्कृष्टकृतम् ।

(१४)

श्रीनेमिजिनस्तुतिः ।

चिक्षेपोर्जितराजकं रणमुखे यो लक्ष्यसंख्यं क्षणा—

दक्षामं जन ! भासमानमहसं राजीमतीतापदम् ।

तं नेमि नम नमनिर्वृतिकरं चक्रे यदूनां च यो

दक्षामञ्जनभासमानमहसं राजीमतीतापदम् ॥ ८५ ॥

शार्दूलविक्रीडितम् ।

(१५)

अम्बादेव्याः स्तुतिः ।

इस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद्

विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् ।

सा भूति वितनोरु नोऽर्जुनरुचिः सिंहेऽधिरूढोङ्गसद्--

विश्वासे वितताम्रपादपरताऽम्बा चारिपुत्राऽसकृत् ॥ ८८ ॥

शार्दूलविक्रीडितम् ।

(१६)

श्रीपार्श्वनाथस्तुतिः ।

मालामालानबाहुर्दधदधदरं यामुदारा मुदारा—

लीनाऽलीनामिहाली मधुरमधुरसां सूचितोमाचितो मा ।

पातात् पातात् स पार्श्वो रुचिररुचिरदो देवराजीवराजी—

पत्राऽपत्रा यदीया तनुरतनुरको नन्दको नोदको नो ॥ ८९ ॥

क्षग्धरावृत्तम् ।

(१७)

जिनेन्द्राणां स्तुतिः ।

राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्गतुरङ्ग—

व्याङ्गव्यालमयोधाचितरचितरणे भीतिहृद् याऽतिहृष्टा ।

सारा साऽरज्जिनानामलममलमतेबोधिका माऽधिकामा—
दब्यादब्याधिकालाननजननजरात्रासमानाऽसमाना ॥ ९० ॥

स्वग्धरावृत्तम् ।

(१८)

जिनवाणीस्तुतिः ।

सद्योऽसद्योगभिद् वाग्मलगमलया जैनराजीनराजी—
नूता नूतार्थधात्रीह ततहततमःपातकाऽपातकामा ।
शास्त्री शास्त्री नराणां हृदयहृदयशोरोधिकाऽबाधिका वाऽस—
देया देयाद् मुदं ते मनुजमनु जरां त्याजयन्ती जयन्ती ॥ ९१ ॥

स्वग्धरावृत्तम् ।

(१९)

श्रीवैरोद्यादेव्याः स्तुतिः ।

याता या तारतेजाः सदसि सदसिभृत् कालकान्तालकान्ताऽ—
पार्णि पारिन्द्रराजं सुरवसुरवधूपूजिताऽरं जितारम् ।
सा त्रासात् त्रायतां त्वामविषमविषभृद्भूषणाऽभीषणा भी—
हीनाहीनाञ्चयपत्नी कुवलयवलयद्यामदेहाऽमदेहा ॥ ९२ ॥

(२०)

श्रीमहावीरजिनस्तुतिः ।

नमद्मरशिरोरुहस्तसामोदनिर्द्रिमन्दा—
रमालारजोरज्जिताहे ! धरीत्रीकृताऽ
वन ! वरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्याव—
लीलापदे हे क्षितामोहिताक्षो भवान् ।
मम वितरु वीर ! निर्वाणशम्राणि जातावतारो
धराधीशसिद्धार्थधाम्नि क्षमालङ्गताऽ
वनवरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्याव !
लीलापदे हे क्षितामो हिताक्षोभवान् ॥ ९३ ॥

अर्णवदण्डकच्छन्दः ।

શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળાનાં પુસ્તકો.

નંબર.	નામ.	ભાષા.	કર્તા યા સંપાદક.	કિંમત.
૧	વિજયધર્મસૂરિ સ્વર્ગવાસ પછી.	ગુજરાતી.	શ્રીવિદ્યાવિજય	૨-૮-૦
૨	ધર્મવિચેગમાળા.	સં. કાન્ય.	શ્રીહિમાંશુવિજય	૦-૨-૦
૩	પ્રમાણનયતત્ત્વાલોક (સટીક)	સં. ન્યાય	„	૦-૧૪-૦
૪	આવક્ષાયાર	હિન્દી	શ્રીવિદ્યાવિજય.	૦-૪-૦
૫	વિજયધર્મસૂરિ કે વચનકુસુમ	„	„	૦-૪-૦
૬	„	ગુજરાતી	„	૦-૪-૦
૭	સેંચન ઓદ્ડ વિજયધર્મસૂરિ	અ. એઝ	ડૉ. કૌરે	૦-૪-૦
૮	જ્યાનતપ્રયાન્ધ	સંસ્કૃત-ગુ.	શ્રીહિમાંશુવિજય	૦-૩-૦
૯	વિજયધર્મસૂરિ અષ્ટપ્રકારી પૂજા	હિન્દી	શ્રીવિદ્યાવિજય	૦-૪-૦
૧૦	આખૂ (૭૦ ફેટા સાથે)	ગુજરાતી	શ્રીજ્યાનતવિજય	૨-૮-૦
૧૧	વિજયધર્મસૂરિ	ધી. ટો. શાહ	૦-૨-૦	
૧૨	આવક્ષાયાર	„	શ્રીવિદ્યાવિજય	૦-૩-૦
૧૩	શાહી સુલસા	„	„	૦-૩-૦
૧૪	સમયને ઓળખો ભાગ ૧ નો	„	„	૦-૧૨-૦
૧૫	„ ભાગ ૨ નો	„	„	૦-૧૦-૦
૧૬	એન આધીયલમંક	અ. એઝ એ. જે. સુનાવાલા	૫-૦-૦	
૧૭	સમ્યકૃતવપ્રદીપ	ગુજરાતી ઉ. શ્રીમંગલવિજય	૦-૪-૦	
૧૮	વિજયધર્મસૂરિ અષ્ટપ્રકારી પૂજા	„	„	૦-૪-૦
૧૯	નૈની સમપદાર્થી	સંસ્કૃત ન્યાય	શ્રીહિમાંશુવિજય	૦-૫-૦
૨૦	ખલચર્ચ દિગ્દર્શન	ગુજરાતી	શ્રીવિજયધર્મસૂરિ	૦-૩-૦
૨૧	„	હિન્દી	„	૦-૩-૦
૨૨	વક્તા બનો	ગુજરાતી	શ્રીવિદ્યાવિજય	૦-૬-૦
૨૩	મહાકૃષ્ણાલનમુનિ અને તેમની કૃતિ ગુજરાતી	શ્રીહિમાંશુવિજય	૦-૩-૦	
૨૪	ખાલથુવાડા	„	શ્રીજ્યાનતવિજય	૦-૪-૦
૨૫	નૈતત્ત્વગ્રાન	ગુજરાતી	શ્રીવિજયધર્મસૂરિ	૦-૪-૦
૨૬	ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ ૪ થો. (કમળ સંયમી ટીકા) સં. શ્રીજ્યાનતવિજય	૮-૦		
૨૭	પ્રમાણનયતત્ત્વાલોક-પ્રસ્તાવના	સંસ્કૃત	શ્રીહિમાંશુવિજય	૦-૩-૦

વિશીષ પુસ્તકો.

વક્તા અનો: - દંડાઈ રહેલી વક્તવ્ય શક્તિનો વિકાસ કરવાની ઘણ્યા રાખનાર હરકોઈ આ પુસ્તકને વાંચો. પોતાની અજર્ય વક્તવ્ય શક્તિથી હજારો મનુષ્યોની સભાને ડેલાવનાર, રાજ મહારાજને અમલૃત કરનાર પ્રખર વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યળ મહારાજે પોતાના પર્યાશ વર્ણનો અનુભવ આમાં નાખ્યો છે. સાધુ કે ગૃહરથ કોશ્યપણુ ઉપરેશક આ પુસ્તકને વાંચો એલવાની સારી શક્તિ મેળવી શકે છે. કિંમત ૦-૬-૦ છે.

આખ્ય:—(પહેલો ભાગ) આખ્ય પર્વત ઉપર રહેલાં નૈન-અનૈન ફરેક પ્રમિષ રથલો વિષે આમાં પ્રામાણિક માહિતી આપી છે. ૭૫ દ્વારાઓ આ પુસ્તકમાં આપ્યાં છે. ચાંચના કર્તા મુનિરાજ શ્રી જ્યંતવિજ્યળ મહારાજ છે. કિંમત રૂ. ૨-૮-૦

સમયને ઓળખો—(ભાગ ૧-૨) સામાજિક કુર્દિઓ સામે એકો અળવો જગ્યાડનાર મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યળ મહારાજના લખેલા અનેક કાંતિકારી દેખો આ બન્ને ભાગોમાં છે. બન્ને ભાગની કિંમત રૂ. ૧-૬-૦



मुनि श्री हिमांशुविजयज्ञनां पुस्तक (संशोधित तथा रचेलां)

१ प्रभाणुनयतत्वालोक सटीक (न्याय) :- वाहिनीतामां प्रसिद्ध छे. आना उपर पं. रामगोपालाचार्यां थाय तेनी टीका छे. पहेलीज वार ते टीका साये मूळ अंथने नवी पद्धतिए संशोधित करवामां आयो. छे. खास करी आनी प्रस्तावनामां नैन न्याय निषे सारो प्रकाश पाखो छे. मूळ अंथकारना छुवन विषे तथा अंथ विषे जाणुवा नैनी धर्षी आयतो आमां लणी छे. किमत १४ आना.

२ जैनी संसपदार्थी (न्याय) :- नैन न्यायमां प्रवेश करवा भाटे आ अंथ तडी संथाहुनी गरेज सारे छे. आमां नैन प्रमेय अने नैन प्रभाणुतु वर्णन दूँकाणुमां सुन्दर रीते कुर्यां छे. दरेक विद्यार्थीयोने बणुवामां सुबल पडे ते भाटे आमां चार परिशिष्टो युज्जरातीमां योन्यां छे. प्रस्तावनामां अंथ अने अंथकारनी आलोचना करी छे. आना कर्ता श्री यशस्वत् सागर गणिषु छे. किमत पांच आना.

३ सिद्धहेमचंद्रशष्ठानुशासनलघुवृत्ति (व्याकरण) :- कलिकाल सर्वस श्री हेमचन्द्राचार्यना व्याकरणुनी भडता भोटाभोटा विद्वाने जाणी गया छे. आ व्याकरणु सिद्धराज सोलांकीनी प्रार्थनाथा अन्युँ छे सरल अने पूर्ण छे नवी पद्धतिए आने संपादित कुर्यां छे. विविध दृष्टिए उपयोगी आमां सात परिशिष्टो योन्यां छे. भद्रत्वनी प्रस्तावना अने विषयानुक्रम पाय छे. कठिन स्थबे इत्पायु पायु कुर्यां छे. आ अंथने श्री आणंदजु कल्याणुनी गेडीए भद्रार पाखो छे. त्याथी समीआ छा भां भणी शके छे.

४ धर्म विग्रहमाणा (काव्य) :- श्री विजयधर्मसूरिना निर्वाण पटी तेमना विग्रहथी आ काव्यनी उत्पत्ति थध छे. आमां संस्कृत विग्रे सात भाषायोनां ७७ पद्यो छे. काव्यप्रेमायो आने पसंद करे छे. [किमत ≡].

५ ज्यन्त प्रभांधा (चरित्र) :- आमां शांतभूर्ति मुनिराज श्री ज्यन्त-विजयज्ञनो दूँक परिचय छे. अंथ संस्कृत भाषानी कवितामां छे. युज्जराती अनुवाद पाणु साये ज छे. [किमत ≡].

अथवा.

प्राप्तिस्थान.

ज्ञेति कार्यालय-नगरशाह. मारकाट रतनपोण अमाधावाद.	} मंत्री:- विजयधर्मसूरि जैन अंथमाणा छाया सराइ उज्जैन (भागवा)
---	--

नोट:- यीन पुस्तको भाटे अंथमाणानु सूचीपत्र भंगावो.